



**Shri Govind Guru University, Godhra**  
(Established Vide Gujarat Act No. 24/2015)

**શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા**

(ગુજરાત એક્ટ નં. ૨૪/૨૦૧૫ દ્વારા સ્થાપિત)

નં.એસજીજીયુ/વહીવટ/૨૦૨૦/૨૬૫૩

તા.૦૬/૦૩/૨૦૨૦

પરિપત્ર-૨૦૨૦

વિષય- કોલેજોને નોવેલ કોરોના વાઇરસ અંગે સલાહ આપવા બાબત.

સંદર્ભ- યુ.જી.સી. ગ્રાન્ટ કમીશનનો તા.૦૫/૦૩/૨૦૨૦નો પત્ર ક્રમાંક D.o.No.F.No.1-14/2020(Website)

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો/માન્ય પી.જી. કેન્દ્રોના આચાર્યશ્રીઓ/પ્રોફેસર ઇન્ચાર્જશ્રીઓ તથા બિન-શૈક્ષણિક કર્મચારીઓને ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે ભારત સરકારશ્રીના માનવ સંસાધન વિકાસ મંત્રાલય તથા પરિવાર અને આરોગ્ય કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નીચેના દર્શાવેલ સૂચનો મુજબ નોવેલ કોરોના વાઇરસ (COVID19) અંગે જરૂરી સુચના થતા તેના ફેલાવાને અટકાવવાના મુદ્દાઓ જણાવવામાં આવે છે. જે ધ્યાને લઈ આપની કોલેજના વિદ્યાર્થીઓ તથા તમામ સ્ટાફને માહિતગાર કરવા અને કોલેજ કેમ્પસમાં જણાવ્યા મુજબની તકેદારી રાખવા વિનંતી.

❖ નોવેલ કોરોના વાઇરસ (COVID19) અંગે જરૂરી સલાહ અને સૂચનો-

- કોલેજ સંકુલમાં મોટી ભીડ એકત્રિત કરવી તથા ભીડ થાય તેવા કાર્યક્રમોનું આયોજન ટાળવા જણાવવામાં આવે છે.
- કોઈ પણ વિદ્યાર્થી/કર્મચારી કે જે કોઈ પણ COVID-19 અસરગ્રસ્ત દેશમાંથી છેલ્લા ૨૮ દિવસમાં આવી હોઈ. તેવી વ્યક્તિ સાથેના સંદર્ભમાં મુસાફરીના ઇતિહાસની માહિતી મેળવવી સાથે તેનું નિરીક્ષણ કરાવવું જોઈએ અને ૧૪ દિવસ માટે ઘરે રાખવા અને યોગ્ય સારવાર લેવા જણાવવું.
- તાવ, ઉધરસ અને શ્વાસ લેવાની તકલીફ જેવા સંકેત અને લક્ષણો ધરાવતા કોઈપણ વિદ્યાર્થી પ્રત્યે ફેકલ્ટીએ સાવચેત રહેવું જોઈએ, એટલે કે તેવા વિદ્યાર્થીઓનું તરત જ પરીક્ષણ કરાવવું જોઈએ.
- સારવાર કરનાર ડોક્ટર દ્વારા યોગ્ય સલાહ આપવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીએ સંકુલમાં જોડાવું ન જોઈએ.
- ફેકલ્ટી સ્ટાફ તથા વિદ્યાર્થીને પણ હાથ અને સેનિટાઇઝરના સામાન્ય સ્વાસ્થ્યપ્રદ પગલાં વિશે સલાહ આપવી જોઈએ, પછી ભલે હાથ સ્પષ્ટ રીતે સાફ હોય.






**Shri Govind Guru University, Godhra**  
(Established Vide Gujarat Act No. 24/2015)

**श्री गोविंद गुरु युनिवर्सिटी, गोधरा**

(गुजरात अेकट नं. २४/२०१५ द्वारा स्थापित)

- ❖ हाथनी स्वच्छता: हाथ स्पष्टरूपे साफ़ होय त्यारे पण, हाथने वारंवार अने सारी रीते साबु अने पाणीथी घोवा अथवा आल्कोहोल आधारित हेन्ड सेनिटाइजरनो उपयोग करवो.
- ❖ श्वसन स्वच्छता:
  1. ज्यारे भांसी आवे छे अथवा छींक आवे छे अने पछीथी हाथ घोवामां आवे छे त्यारे दरेक व्यक्तिअे टीस्यु/रुमाल (अथवा त्यां कोई टीस्यु उपलब्ध न होय तो तेमना स्लीव) थी मों साफ़ करवुं जोईअे.
  2. तमारी आंभो, नाक अने मों वारंवार अडशो नहीं
  3. दरेक व्यक्तिअे वपरायेला टीस्युने बंध डब्बामां डेंकी देवा जोईअे अने भांसी/छींक आववानी बाबतमां संवेदना पछी हाथ घोवा जोईअे.
- वारंवार सपाटी परना दरवाजांनी नोब्स, स्वीचो, डेस्क टोप्स, हेन्ड रेलिंग वगैरेने जुवाणुनाशित करवा जोईअे.
- युनिवर्सिटी/कोलेजोना सामान्य स्थानोमां आल्कोहोल आधारित हेन्ड क्लीनर्स/सेनिटाइजर्स प्रदान करवा.
- रेस्ट रुममां दरेक समये साबु अने पाणीनी उपलब्धतानी भातरी करवी.
- प्लास्टिकनी थेली साथेनी पेडलवाणी कचरापेटी (पगथी भोली शकय तेवी) दरेक वर्गभंड अने आराम रुममां प्रदान करवी जोईअे.
- होस्टेलमां विद्यार्थीअोनी आरोग्यनी स्थिति तेमज अन्य आनुषंगिक बाबतोनुं नियमित धोरणे निरीक्षण करवुं जोईअे. आवा किस्सामां त्यां शंकास्पद केसो होय तो अधिकृत स्थानिक तबीबी सत्ताने परीक्षा माटे बोलाववा जोईअे.
- वाठरसना यिहो अने लक्षणो जेवा के उधरस, ताव अथवा श्वास लेवामां तकलीफ़ धरावता कोईपणने राज्य हेल्पलाइन नंबर पर अथवा परिवार अने आरोग्य कल्याण मंत्रालयना २४x७ हेल्पलेइन नं. ०११ २३६७८४५ पर संपर्क करवो जोईअे अथवा मों मास्कथी ढांकी जाहेर करेल जाहेर आरोग्य सुविधा केन्द्रनी मुलाकात लेवी जोईअे.

  
डा. कुलसचिव  
श्री गोविंद गुरु युनिवर्सिटी  
गोधरा

प्रति,

- श्री गोविंद गुरु युनिवर्सिटी संलज्ज तमाम कोलेजो/मान्य पी.जु. केन्द्रोना आचार्यश्रीअो/प्रोफ़ेसर  
छन्याजश्रीअो तथा बिन-शैक्षणिक कर्मचारीअो तरफ़ जाण तथा जरूरी कार्यवाही सांरुं.

Address: Govt. Polytechnic Campus, RTO Road, Gadukpur, Godhra, Panchmahal, Gujarat-389001

Website: [www.sgggu.ac.in](http://www.sgggu.ac.in)





प्रो. रजनीश जैन  
सचिव  
Prof. Rajnish Jain  
Secretary



विश्वविद्यालय अनुदान आयोग  
University Grants Commission

(मानव संसाधन विकास मंत्रालय, भारत सरकार)  
(Ministry of Human Resource Development, Govt. of India)

बहादुरशाह जफर मार्ग, नई दिल्ली-110002  
Bahadur Shah Zafar Marg, New Delhi-110002

Ph.: 011-23236288/23239337  
Fax: 011-2323 8858  
E-mail: secy.ugc@nic.in

D.O. No.F.No.1-14/2020 (Website)

5<sup>th</sup> March, 2020

Dear Madam/Sir,

This is in reference to communications received from Secretary, Department of Health and Family Welfare and Joint Secretary (HE), MHRD regarding taking preventive measures to combat the threat of the Novel Coronavirus (COVID-19), as some cases of the virus have been reported in the country. Towards this, a coordinated and collective effort in a mission mode is needed, therefore all universities and their affiliated colleges are requested to take necessary precautions and follow the advisory given below to help in prevention /reduction of the transmission of the virus.

#### Advisory for Universities and Colleges – Novel Coronavirus (COVID19)

##### Universities and Colleges are advised to:

- Avoid large gatherings on campus.
- Any student/ staff with travel history to any COVID-19 affected country or in contact with such persons in last 28 days, should be monitored and home quarantined for 14 days.
- Faculty should be alert towards any student with signs and symptoms i.e. fever, cough and difficulty in breathing, and should immediately have the student tested.
- Till advised by the treating doctor the student should not join campus.
- Faculty staff and students should also be advised about simple public health measures of hand and respiratory hygiene.

**Hand hygiene:** Wash hands frequently and thoroughly with soap & water or use alcohol based hand sanitizer, even when hands are visibly clean.

##### Respiratory hygiene:

1. Everyone should cover their mouth with a tissue/handkerchief (or their sleeve if there are no tissues available) when they cough or sneeze and wash their hands afterwards.
  2. Do not touch your eyes, nose and mouth.
  3. Everyone should throw away used tissues in a bin and wash their hands after contact with coughing/sneezing.
- Frequently touched surfaces – door knobs, switches, desk tops, hand railings etc, should be disinfected.
  - Provide alcohol based hand cleaners/sanitizers in frequented spots of the universities/colleges.
  - Ensure availability of soap and water in rest rooms at all times.
  - Foot operated pedal bins lined with plastic bag should be provided in each classroom & rest room.
  - In hostels, health status of students as well as the other ancillary staff should be monitored on regular basis. In case, there are suspected cases, the authorized local medical authority should be called for examination.
  - Anybody with signs & symptoms (cough, fever or difficulty in breathing) should call State/UT helpline number or Ministry of Health & Family Welfare's 24X7 helpline at 011 2397846 or visit public health facility with a mask or mouth covered

An information pamphlet received from the Ministry of Health & Family Welfare to sensitize the students is enclosed.

With regards,

Yours sincerely,

(Rajnish Jain)

Encl: As above


**The Vice-Chancellors of all Universities**





Ministry of Health & Family Welfare  
Government of India


# Reduce the risk of Coronavirus infection Follow these important precautions




Avoid travel if you are suffering from fever and cough



Wash your hands frequently with soap and water



Share your travel history with your health worker (ASHA/ ANM)



If you have cough, fever or difficulty in breathing, contact a doctor immediately

**Stay protected!**

**Stay safe from Coronavirus!**

If you have returned from Wuhan China after January 15, then get yourself tested for 2019-nCov. To know about the centres for testing, call the Ministry of Health and Family Welfare Helpline

If you have returned from China in the last 15 days or have been in contact with any person affected by Coronavirus, then limit your contact with others and use a separate room for sleeping

If you develop fever, cough and difficulty in breathing within 28 days of return from China, immediately call the Ministry of Health and Family Welfare Helpline



**+91-11-23978046**

or email at [ncov2019@gmail.com](mailto:ncov2019@gmail.com)





Ministry of Health & Family Welfare  
Government of India


# Reduce the risk of Coronavirus infection Follow these important precautions



1

After coughing and sneezing

Remember  
to wash  
hands  
with soap  
frequently




4

After using toilet




2

Clean your hands before and  
after caring for sick person



3

Before cooking, after cooking  
and before eating food



If you have cough, fever  
or difficulty in breathing,  
contact a doctor immediately

**Stay  
protected!**

**Stay safe from  
Coronavirus!**

If you have returned  
from Wuhan China after  
January 15, then get  
yourself tested for  
2019-nCoV. To know  
about the centres for  
testing, call the Ministry  
of Health and Family  
Welfare Helpline

If you have returned  
from China in the last  
15 days or have been in  
contact with any person  
affected by Coronavirus,  
then limit your contact  
with others and use a  
separate room for  
sleeping

If you develop fever,  
cough and difficulty  
in breathing within  
28 days of return  
from China,  
immediately call the  
Ministry of Health  
and Family Welfare  
Helpline



**+91-11-23978046**

or email at [ncov2019@gmail.com](mailto:ncov2019@gmail.com)






Ministry of Health & Family Welfare  
Government of India

# Reduce the risk of Coronavirus infection


## Follow these important precautions



1  
Wash hands with soap and water frequently



2  
When coughing and sneezing, cover mouth and nose with handkerchief, tissue or elbow



3  
Avoid close contact with anyone with cold, cough or flu like symptoms



If you have cough, fever or difficulty in breathing, contact a doctor immediately

**Stay protected!**

**Stay safe from Coronavirus!**

If you have returned from Wuhan China after January 15, then get yourself tested for 2019-nCoV. To know about the centres for testing, call the Ministry of Health and Family Welfare Helpline

If you have returned from China in the last 15 days or have been in contact with any person affected by Coronavirus, then limit your contact with others and use a separate room for sleeping

If you develop fever, cough and difficulty in breathing within 28 days of return from China, immediately call the Ministry of Health and Family Welfare Helpline



**+91-11-23978046**

or email at [ncov2019@gmail.com](mailto:ncov2019@gmail.com)